

પોરબંદર જીલ્લાની અઠવાડીક તા.૦૮/૦૩/૨૦૨૧ થી તા.૧૪/૦૩/૨૦૨૧ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬ ની માહિતી નીચે મુજબ છે.

મુદ્દા નંબર ૧:- જો જીલ્લા શહેર કક્ષાએ કોઈ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય:-

- (૧) નવીબંદર પો.સ્ટે. જા.જોગ નં.૦૩/૨૦૨૧ તા.૨૨/૦૨/૨૦૨૧ના કામે ગુમ થનાર સાહિસ્તાબેન વા/ઓ જુમાભાઈ ઢીમર ઉ.વ.૨૫ તથા સાથે તેની ટિકરી અરબીના ઉ.વ.૧ વર્ષ રહે. બન્ને ગોસાબારા જી.પોરબંદર વાળાઓને માલેગાંવ ગોસીયાનગર રમજાનપુરા જીલ્લો-નાસીક(મહારાષ્ટ્ર)થી તેમના માતા-પિતાના ઘરેથી તા.૦૮/૦૩/૨૦૨૧ના રોજ નવીબંદર પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. શ્રી આર.એમ.ખુંટી તથા પોલીસ સ્ટાફના માણસોએ શોધી કાઢેલ છે.
- (૨) કમલાબાગ પો.સ્ટે. ગુમ જા.જોગ નં.૧૪/૨૦૨૧ તા.૧૧/૦૩/૨૦૨૧ ના રોજ ગુમ થનાર અવેશ સ/ઓ ઇકબાલભાઈ આરબડા ઉ.વ.૨૨ રહે. બીરલા કોલોની ઇન્દીરાનગર મામાદેવ વાળી ગલી પોરબંદર વાળાને તા.૧૨/૦૩/૨૦૨૧ ના કમલાબાગ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ.શ્રી જે.ડી.દેસાઈ તથા પોલીસ સ્ટાફના માણસોએ શોધી કાઢેલ છે.
- (૩) ઉદ્યોગનગર પો.સ્ટે. ગુમ જા.જોગ નં.૦૩/૨૦૨૧ તા.૦૮/૦૩/૨૦૨૧ ના રોજ ગુમ થનાર રીધીબેન વા/ઓ જય અશ્વીનભાઈ ગોહેલ ઉ.વ.૩૧ રહે. હજુર પેલેસ માછલી ઘર સામે પોરબંદર વાળીને તા.૧૪/૦૩/૨૦૨૧ ના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના ઇ.યા.પો.સબ.ઇન્સ.શ્રી આર.એલ.મકવાણા તથા પોલીસ સ્ટાફના માણસોએ શોધી કાઢેલ છે.

મુદ્દા નંબર ૬:- અન્ય લોકહીતની બાબતો જે લોકોને તુરંત જ ધ્યાન પર આવે તેવી બાબતો—

- (૧) તા.૧૧/૦૩/૨૦૨૧ ના રોજ ઉદ્યોગનગર પો.સ્ટે.માં એ.એસ.આઈ જે.પી.નંદાણીયા પી.એસ.ઓ ફરજ પર હતા. તે દરમિયાન ક.૧૩/૧૫ વાગ્યે અરજદાર અનિતાબેન વા/ઓ વિનોદભાઈ પરસોતમભાઈ સલેટ ઉ.વ.૨૯ રહે.નાગરવાડા પોરબંદરએ પો.સ્ટે. આવી જાણ કરેલ કે, પોતે નરસંગટેકરી થી આશાપુરા ચોક તરફ આવતા હતા. તે દરમિયાન પોતાના સેમસંગ કંપનીનો J7 કી.રૂ.૧૦,૦૦૦/- નો નરસંગ ટેકરી થી આશાપુરા વિસ્તારમાં પડી ગયેલ. જે અંગે અરજદારે તપાસ કરતા મળી આવેલ નહી તેવું જણાવતા ફરજ પરના પી.એસ.ઓ દ્વારા નરસંગ ટેકરી પોઈન્ટ પર ફરજ બજાવતા પોલીસ સ્ટાફને આ બાબતેની જાણ કરતા ત્યાં ફરજ પરના પોલીસ સ્ટાફ તથા SRD સભ્ય દ્વારા મોબાઈલ ની શોધ-ખોળ કરતા SRD સભ્ય આશિફભાઈ સૈયદને નરસંગટેકરી નજીક થી અરજદારનો પડી ગયેલ મોબાઈલ મળી આવતા. અરજદારને પો.સ્ટે. બોલાવી અરજદારને તેમનો ફોન પરત આપેલ.

જે આપશ્રીને વિદિત થાય.

(ભરત પટેલ)

ના.પો.અધિ.મુ.મ. અને

નોડલ ઓફીસર eGujcop

પોરબંદર